

Semester - 2

Sub Code	Subject Name	Hours	Credit	Internal	External	Total
CC3	Philosophical and Sociological Foundation of Education	4	4	30	70	100
CC4	School Policies and Administration	4	4	30	70	100
EC	Pedagogy of School Subject - 1 (Part-2)	2	2	15	35	50
EC	Pedagogy of School Subject - 2 (Part-2)	2	2	15	35	50
SSC	School Subject - 1 (Part-2)	2	2	15	35	50
SSC	School Subject - 2 (Part-2)	2	2	15	35	50
		16	16	120	280	400

Assignment / Task / Practical Work - Semester : 2

Sr. No.	Title	Hours	Credit	Internal	External	Total
1	Stray Lesson - 5	2	2	50	0	50
2	Observation of Lesson - 10 (Stray - 5 + Unit - 5)	2	2	50	0	50
3	Unit Lesson - 1 (4 + 1)	2	2	50	0	50
4*	School Subject Analysis and framing Comprehension questions (SSC, MCQ Questions 100, 1 + 1)	2	2	50	0	50
5	Construction of TLM (Main Method / Admission Method)	1	1	25	0	25
		9	9	225	0	225

* કાંપેક મેથડમાંથી MCQ પ્રકારના ૨૫ પ્રશ્નો.

* કાંપેક કાન્ટાટમાંથી MCQ પ્રકારના ૭૫ પ્રશ્નો.

CC3 : PHILOSOPHICAL AND SOCIOLOGICAL FOUNDATION OF EDUCATION

એકમ - ૧	<p>કેળવણી અને કેળવણીકારો</p> <p>૧.૧ કેળવણી : અર્થ (શાલ્લિક, સંકુચિત, વ્યાપક અર્થ) કેળવણીની વ્યાખ્યાઓ, ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપ</p> <p>૧.૨ કેળવણી પર અસરકરતા પરિબળો (તાત્ત્વિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજકીય)</p> <p>૧.૩ સ્ત્રી કેળવણીનું મહત્વ</p> <p>૧.૪ સ્ત્રી કેળવણીને વ્યાપક બનાવવાના સંદર્ભમાં સરકારનાં પ્રયત્નો અને યોજનાઓની યાદી</p> <p>૧.૫ ગાંધીજી, ટાગોર, ડૉ. રાધાકૃષ્ણાન્ન અને વિવેકાનંદના તત્ત્વચિંતનનો નીચેના મુદાઓનાં સંદર્ભમાં અભ્યાસ (જીવન-કવન, કેળવણીની સંકલ્પના, શિક્ષણના છોયો, અભ્યાસક્રમ, અધ્યયન અધ્યાપન પદ્ધતિ, ગુરુ-શિષ્ય સંબંધ અને શિસ્ત)</p>	૨૫%
એકમ - ૨	<p>તાત્ત્વિક વિચારસરણીઓ</p> <p>૨.૧ તત્ત્વજ્ઞાન અને શૈક્ષણિક તત્ત્વજ્ઞાનની સંકલ્પના</p> <p>૨.૨ તત્ત્વજ્ઞાન અને કેળવણી વચ્ચેનો સંબંધ</p> <p>૨.૩ તાત્ત્વિક વિચારસરણીઓ : આદર્શવાદ, વ્યવહારવાદ, પ્રકૃતિવાદ અને વાસ્તવવાદનો નીચેના મુદાઓનાં સંદર્ભમાં અભ્યાસ (પરિચય, પુરસ્કર્તાઓ, શિક્ષણનો અર્થ, શિક્ષણના છોયો, અભ્યાસક્રમ, અધ્યયન-અધ્યાપન પદ્ધતિ, ગુરુ-શિષ્ય સંબંધો અને શિસ્ત)</p>	૨૫%
એકમ - ૩	<p>માનવ અધિકાર અને શાંતિ માટેની કેળવણી</p> <p>૩.૧ માનવ અધિકારનો પાશ્ચાદ ભૂમિકા, અર્થ, સ્વરૂપ, મહત્વ અને ઉદ્દેશો</p> <p>૩.૨ શાંતિ માટેની કેળવણી અને નિઃશસ્ત્રીકરણ : અર્થ, પ્રવર્તમાન પરિસ્થિતિમાં તેની જરૂરિયાત</p> <p>૩.૩ રાષ્ટ્રીય ઐક્ય : અર્થ, જોડનારા અને વિઘટન કરનારા પરિબળો અને રાષ્ટ્રીય ઐક્ય વિકસાવવામાં શાળાની ભૂમિકા</p> <p>૩.૪ આંતરરાષ્ટ્રીય સમજ, અર્થ અને જરૂરીયાત</p> <p>૩.૫ આંતરરાષ્ટ્રીય સમજ અને સહકાર વિકસાવવાના શાલેય કાર્યક્રમો</p> <p>૩.૬ મૂલ્ય શિક્ષણ : અર્થ, પ્રકાર, અભિગમ અને પ્રવર્તમાન સમયમાં તેની જરૂરીયાત</p>	૨૫%

એકમ - ૪	ભારતીય સંસ્કૃતિ, સત્યતા, લોકશાહી અને શિક્ષણ	૨૫%
૪.૧	ભારતીય રાજ્ય બંધારણઃ આમુખ, શિક્ષણ સંબંધી કલમો	
૪.૨	લોકશાહીનો અર્થ અને તેના આધાર સ્તંભો	
૪.૩	લોકશાહીના સંદર્ભમાં વ્યક્તિત્વાત અને સામાજિક ઘેયો	
૪.૪	બિન સાંપ્રદાયિકતાઓ અર્થ અને જરૂરિયાત	
૪.૫	ભારતીય સંસ્કૃતિ અને સત્યતા : અર્થ, લાક્ષણ્યિકતાઓ, તુલના	
૪.૬	ભારતીય સંસ્કૃતિક વારસો : (સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, લદિતકલા અને સામાજિક રીત – રિવાજોના સંદર્ભમાં	
૪.૭	ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં શાળાકીય પ્રવૃત્તિ	

CC4 : SCHOOL POLICIES AND ADMINISTRATION

એકમ - ૧	શાળા વ્યવસ્થાપન અને શિક્ષણ વર્તીવટ ૧.૧ શાળા વ્યવસ્થાપનની સંકલપના ૧.૨ શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ, હેતુઓ અને કાર્યક્ષેત્ર ૧.૩ શાળા દફ્તર (GR, LC, રજી અરજી, હાજરી પત્રક, ડેડ સ્ટોક, સર્વીસ બુક પરિચય) તથા વિવિધ પ્રકારની રજાઓ ૧.૪ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થી મૂલ્યાંકનના પ્રવર્તનમાન માળખાનો પરિચય ૧.૫ DPEO, TPEO, કેન્દ્ર, BRC, CRC ની ફરજો	૨૫%
એકમ - ૨	વિદ્યાર્થી – શિક્ષક અને આચાર્ય ૨.૧ વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ ૨.૨ શિક્ષક ૨.૨.૧ પ્રવર્તમાન શિક્ષક ભરતી પ્રક્રિયા (TET-II, TAT for Secondary and Higher Secondary ના સંદર્ભમાં) ૨.૨.૨ શિક્ષકોની ફરજો (અધિનિયમને આધારે) ૨.૨.૩ શિક્ષકના કાર્ય સંતોષ પર અસરકૃતા પરિબળો ૨.૩ આચાર્ય ૨.૩.૧ પ્રવર્તમાન આચાર્ય ભરતી માટેની પ્રક્રિયા (HTAT (પ્રાથમિક આચાર્ય), TAT (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્યના સંદર્ભમાં)) ૨.૩.૨ આચાર્યની ભૂમિકા અને કાર્યો (આયોજન, વ્યવસ્થાપન, દોરવણી અને અંકુશના સંદર્ભમાં) ૨.૪ શિસ્ત અને તેના પ્રકારો (મુક્ત, દમન યુક્ત અને પ્રભાવશાળી)	૨૫%
એકમ - ૩	વિવિધ બોર્ડ, શાળા અને સંસ્થા પરિચય ૩.૧ સ્ટેટ બોર્ડ (સંકલપના, કાર્યો) ૩.૨ CBSE બોર્ડ (સંકલપના, કાર્યો) ૩.૩ ICSE બોર્ડ (સંકલપના, કાર્યો) ૩.૪ વિવિધ પ્રકારની શાળા અને તેમનો સામાન્ય પરિચય (જલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, અનુદાનિત અને પૂર્ણ સરકારી, માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓ, જવાહર નવોદય વિદ્યાલયો, કેન્દ્રીય વિદ્યાલયો, મોડેલ સ્કૂલ્સ, બહેરા મૂંગા—અંધ અને માનસિક અસ્વસ્થ બાળકોની વિશિષ્ટ શાળા) ૩.૫ પરિચય – GCERT, CASE, IASE, DIET, NCTE, STTI, UGC, KCG	૨૫%

એકમ - ૪	શિક્ષણ સંબંધી સરકારના વિવિધ ધારા અને શિક્ષણ માળખું	૨૫%
૪.૧	પ્રાથમિક શિક્ષણના સંદર્ભમાં રાજ્ય સરકારના પ્રવર્તમાન ધારાની સમજૂતી અને સમાવિષ્ટ	
	બાબતોનો સામાન્ય અભ્યાસ	
૪.૨	માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં રાજ્ય સરકારના પ્રવર્તમાન ધારાની સમજૂતી અને તેમાં સમાવિષ્ટ બાબતોનો સામાન્ય અભ્યાસ	
૪.૩	રાજ્ય કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું તથા ઉચ્ચ શિક્ષણ કમિશનરના કાર્યો અને ફરજો	
૪.૪	જિલ્લા કક્ષાનું માધ્યમિક શિક્ષણનું વહીવટી માળખું તથા જિલ્લા શિક્ષણાધિકારીનાં કાર્યો અને ફરજો	

EC1 : ગુજરાતી પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	માતૃભાષા શિક્ષણનું આયોજન	૨૫%
	૧.૧ પાઠ આયોજન : સંકલના, મહત્વ અને સોપાનો	
	૧.૨ તાસ આયોજન : એકમ આયોજન સામ્ય : વૈભભ્ય	
	૧.૩ એકમ આયોજન : સંકલના, સોપાનો	
	૧.૪ છૂટા પાઠોનું આયોજન : ગાંધી, પદ્ધતિ, વ્યાકરણ, લેખન	
	૧.૫ એકમ આયોજન : ગાંધી, પદ્ધતિ, વ્યાકરણ, લેખન	
એકમ - ૨	માતૃભાષા શિક્ષણને અસરકારક બનાવતા ઉપકરણો	૨૫%
	૨.૧ દ્રષ્ટિગમ્ય, શુદ્ધિગમ્ય અને દ્રષ્ટિગમ્ય—શુદ્ધિગમ્ય	
	૨.૨ શબ્દકોશ, વિશ્વકોશ, ભીતપત્ર, ચાર્ટ, ટેપરેકોર્ડર, ભાષ પ્રયોગશાળા, કમ્પ્યુટર, ફ્લેશકાર્ડ : સ્વરૂપ અને ઉપયોગિતા	
એકમ - ૩	માતૃભાષા શિક્ષણમાં ઉપયોગી સહઅભ્યાસ પ્રવૃત્તિઓ (સંકલના અને ઉપયોગિતા)	૨૫%
	૩.૧ નાટ્યકારણ	
	૩.૨ કવિસભા	
	૩.૩ અંકગ્રાફાશન	
	૩.૪ વાર્તાલાપ જોડણી સુધાર પ્રવૃત્તિ	
	૩.૫ શબ્દ રમત	
એકમ - ૪	માતૃભાષા શિક્ષણનું મૂલ્યાંકન	૨૫%
	૪.૧ આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો	
	૪.૨ નિબંધ પ્રકાર, લઘુજીવાબી અને અનાત્મલક્ષી પ્રશ્નો : રચના, મહત્વ અને મર્યાદાઓ	
	૪.૩ પ્રશ્નપત્રની રચનામાં ત્રિપરિમાણ દર્શક સારણીની આવશ્યકતા અને સંરચના	

EC2 : हिन्दी पद्धति (सेम. २)

इकाई - १	शैक्षिक उपकरण - उपयोग एवं महत्व	२०%
१.१	पाठ्यपुस्तक	
१.२	श्यामफलक	
१.३	शब्दकोश	
१.४	चार्ट-चित्र	
१.५	फिल्म	
इकाई - २	आयोजन	४०%
२.१	गद्य, पद्म, रचना एवं व्याकरण के संदर्भ में तास एवम् इकाई योजना	
२.२	श्रवण, कथन, पठन एवं लेखन कौशल्यों के विकास का महत्व एवं प्रवृत्तियाँ	
२.३	निदानात्मक एवं उपचारात्मक शिक्षा	
इकाई - ३	परिक्षण एवं मूल्यांकन	२०%
३.१	मूल्यांकन का महत्व एवं प्रसार	
३.२	त्रिपरीमाण दर्शक सारणी एवं प्रश्नपत्र संरचना	
इकाई - ४	भाषा शिक्षक	२०%
४.१	भाषा शिक्षक की महत्ता	
४.२	भाषाकीय योग्यता	
४.३	व्यवसायिक योग्यता	

EC3 : સંસ્કૃત પદ્ધતિ (સેમ. ૧)

એકમ - ૧	સંસ્કૃત ભાષાનું સાંસ્કૃતિક અને સાહિત્યિક મૂલ્ય			૨૫%
	૧.૧ ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ			
	૧.૨ ભારતીય ભાષાઓના વિકાસમાં સંસ્કૃતનું પ્રદાન			
	૧.૨.૧ આદર્શ વાંચનના લક્ષણો			
	૧.૨.૨ વાંચન, લેખન અને ઉચ્ચારણ દોષો તેમજ નિવારવાના ઉપાયો			
	૧.૩ સંસ્કૃત સુભાષિતોનું મહત્વ			
એકમ - ૨	પાઠ આયોજન			૨૫%
	૨.૧ માઈકોટીચિંગ : સંકલ્પના, અગત્ય			
	૨.૨ માઈકોટીચિંગમાં ઉપયોગી કૌશલ્યોનો પરિચય (વિષયાબિમુખ, શ્યામફલક કાર્ય, ઉદાહરણ, પ્રશ્નપ્રવાહિતા, સુદ્રઢિકરણ, સ્પષ્ટીકરણ, ઉતેજના પરિવર્તન)			
	૨.૨.૧ સેતુપાઠ : સંકલ્પના, અગત્યતા (આયોજનના સંદર્ભ)			
	૨.૨.૨ માઈકોટીચિંગ અને સેતુપાઠ વચ્ચેનો તફાવત			
એકમ - ૩	સંસ્કૃત શિક્ષણના હેતુઓ			૨૫%
	૩.૧ પ્રાચીન હેતુઓ			
	૩.૨ અવાચીન હેતુઓ			
	૩.૨.૧ સામાન્ય હેતુઓ			
	૩.૨.૨ વિશિષ્ટ હેતુઓ			
	સામાન્ય હેતુઓ			
	૧. જ્ઞાન	૨. અર્�ગ્રહણ / સમજ	૩. અભિવ્યક્તિ	
	૪. રસાસ્વાદ	૫. ઉપયોગ		
એકમ - ૪	સંસ્કૃત શિક્ષણની પદ્ધતિ અને શૈક્ષણિક સાધનો			૨૫%
	૪.૧ (૧) પ્રત્યક્ષ			(૨) અનુવાદ
	(૩) પ્રત્યક્ષ, અનુવાદ પદ્ધતિની તુલના—ચર્ચા			(૪) સ્વાધ્યાય
	(૫) આગમન—નિગમન			
	(૬) પ્રોજેક્ટ (જેમાં શિક્ષક વ્યવસ્થાપકની ભૂમિકામાં)			
	૪.૨ (૧) ચાર્ટ્સ	(૨) પ્રતિકૂતિ	(૩) ફ્લેનલ કટ્ટસ—બોર્ડ	
	૪.૩ નીચેના સાધનોનો માત્ર પરિચય			
	(૧) ટેપ રેકોર્ડ	(૨) રેડીયો	(૩) ટી.વી.	
	(૪) શિક્ષક હાથપોથી	(૫) કમ્પ્યુટર	(૬) OHP	
	(૬) શાબ્દકોષ			

EC4 : ENGLISH METHOD (SEM - 2)

Unit - 1	Lesson Planning & Procedure	25%
	1.1 Importance of Lesson Planning	
	1.2 Stray Lesson and Unit Lesson Planning in ELT	
Unit - 2	Resources and Problems in ELT	25%
	2.1 Text Book : Importance and Various aspects of Reviewing a textbook	
	2.2 ELT Resources - Dictionary, Thesaurus, Electronic Media	
	2.3 Causes and remedies of the following ELT Problems. (1) Pronunciation (2) Syntax (3) Spelling (4) Handwriting	
Unit - 3	Teaching of Composition and Action Research	25%
	3.1 Teaching of Composition - Types of Composition (Oral-written, controlled - guided) - Forms of Composition (Story, Paragraph, Letter, Essay, Report Writing)	
	3.2 Action Research : Concept and Steps	
Unit - 4	Evaluation	25%
	4.1 Evaluation : Concept and types (Oral-written) - Types of questions and their construction (Essay Type, Short Answer Type, Objective Type)	
	4.2 (i) Essentials of a good question paper (ii) Preparing a Blueprint of a question paper	

EC5 : ગણિત પદ્ધતિ (સેમ. ૨)

એકમ - ૧	<p>પાઠ આયોજનનો વિકાસ</p> <p>૧.૧ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પૂથકકરણ : શિક્ષક-વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ, શૈક્ષણિક પદ્ધતિ – પ્રયુક્તિઓ – અભિગમ, સાધન-સંદર્ભ, મૂલ્યાંકન યોજના</p> <p>૧.૨ છૂટા પાઠનું આયોજન</p> <p>૧.૩ એકમ પાઠનું આયોજન</p> <p>૧.૪ બલ્યુપ્રિન્ટના આધારે એકમ કસોટીની સંરચના</p>	૨૫%
એકમ - ૨	<p>ગણિત શિક્ષણની પદ્ધતિઓ</p> <p>૨.૧ પદ્ધતિઓ : વ્યાખ્યાન પદ્ધતિ : સંકલપના, વર્ગ શિક્ષણમાં વિનિયોગ, લાભ અને મર્યાદા</p> <p>૨.૨ પ્રકલ્પ પદ્ધતિ : સંકલપના, આયોજન માટેના સોપાનો, લાભ અને મર્યાદા</p> <p>૨.૩ સ્વાધ્યાય પદ્ધતિ : સંકલપના, સ્વાધ્યાય પત્રની સંરચના સારા સ્વાધ્યાય પત્રના લક્ષણો, વર્ગ શિક્ષણમાં વિનિયોગ</p>	૨૫%
એકમ - ૩	<p>ગણિત શિક્ષણમાં મૂલ્યાંકન</p> <p>૩.૧ મૂલ્યાંકનની સંકલપના</p> <p>૩.૨ મૂલ્યાંકન પ્રક્રિયાના સાધનો</p> <p>૩.૩ આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો</p> <p>૩.૪ વિવિધ પ્રકારના મૂલ્યાંકન પ્રશ્નો</p> <p>(અ) નિબંધ પ્રકારના (સંકલપના)</p> <p>(બ) ટૂંકોતારી પ્રકારના (સંકલપના)</p> <p>(ક) વસ્તુલક્ષી : (સંકલપના તથા સંરચના) ખાલી જગ્યા, જોડકા, બહુ વિકલ્પ, સંબંધ ઘટાયક</p>	૨૫%
એકમ - ૪	<p>ગણિત શિક્ષણમાં સમૂહિકરણ</p> <p>૪.૧ દર્શિકરણ અને વિહંગાવલોકન : સંકલપના અને વર્ગશિક્ષણમાં વિનિયોગ</p> <p>૪.૨ ગણિત મંડળ : અગત્ય અને પ્રવૃત્તિઓ</p> <p>૪.૩ કિયાત્મક સંશોધન : સંકલપના, સોપાનો અને મહત્વ</p>	૨૫%

EC6 : વિજ્ઞાન પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	પાઈ આયોજનનો વિકાસ ૧.૧ તાસ આયોજન (સંકલપના, સોપાનો) ૧.૨ તાસ આયોજનનું માળખું ૧.૩ એકમ આયોજન ૧.૪ બલ્યુપ્રિન્ટના આધારે એકમ કસોટીની સંરચના	૨૫%
એકમ - ૨	વિજ્ઞાન શિક્ષણની પદ્ધતિઓ ૨.૧ પદ્ધતિઓ : (સંકલપના, અસરકારક બનાવવાના ઉપાયો અને લાભાલાભ)	૨૫%
	૨.૧.૧ વ્યાખ્યાન પદ્ધતિ ૨.૧.૨ સ્વાધ્યાય પદ્ધતિ ૨.૧.૩ નિર્દર્શન પદ્ધતિ ૨.૧.૪ પ્રયોગ પદ્ધતિ ૨.૧.૫ પ્રકલ્પ પદ્ધતિ	
એકમ - ૩	મૂલ્યાંકન અને ડિયાત્મક સંશોધન ૩.૧ પ્રશ્ન પ્રકાર : સંકલપના, સંરચના અને ઉદાહરણ ૩.૧.૧ નિબંધલક્ષી ૩.૧.૨ લઘુજવાઢી ૩.૧.૩ વસ્તુલક્ષી (ખાલીજગ્યા, જોડકાઓ, બહુવિકલ્પ, સંબંધ ઘટાયક, વર્ગીકરણ)	૨૫%
એકમ - ૪	૩.૨ બલ્યુપ્રિન્ટની સંરચના ૩.૩ આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો ૩.૪ ડિયાત્મક સંશોધન : સંકલપના, સોપાનો, મહત્વ વિજ્ઞાન શિક્ષણમાં સહાયક પ્રવૃત્તિઓ અને સંદર્ભો ૪.૧ વિજ્ઞાન પ્રયોગશાળા : મહત્વ, આયોજન, જાળવણી ૪.૨ પ્રવૃત્તિઓ : વિજ્ઞાન મંડળ, વિજ્ઞાન મેળા, ક્ષેત્ર પર્યાટન, આકાશ દર્શન ૪.૩ સંદર્ભો : પ્રયોગ નોંધપોથી, વિજ્ઞાન સામાચિકો	૨૫%

EC7 : ઇતિહાસ પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	પાઠ આયોજનનો વિકાસ	૨૫%
	૧.૧ તાસ પાઠ આયોજન	
	૧.૨ એકમ આયોજન	
	૧.૩ તાસ પાઠ આયોજન અને એકમ પાઠ આયોજનની તુલના	
એકમ - ૨	ઇતિહાસ શિક્ષણની પ્રયુક્તિ	૨૫%
	૨.૧ સંગ્રહસ્થાન, નાટયીકરણ, પ્રવાસ, સમયરેખા (અર્થ – ઉપયોગિતા)	
	૨.૨ ઇતિહાસ ખંડ : અગત્ય, સજાવટ	
	૨.૩ ઇતિહાસ શિક્ષણમાં સમૂહ માધ્યમોની : પસંદગી, અગત્ય : ફિલ્મ, રેડિયો, ટી.વી., વી.સી.ડી., ટેપરેકોર્ડર	
એકમ - ૩	ઇતિહાસનો અન્ય વિભયો સાથે અનુબંધ	૨૫%
	૩.૧ ઇતિહાસ – ભૂગોળ	
	૩.૨ ઇતિહાસ – વિજ્ઞાન	
	૩.૩ ઇતિહાસ અને નાગરિકશાસ્ત્ર	
	૩.૪ ઇતિહાસ અને સ્થાનિક ઇતિહાસ	
	૩.૫ ઇતિહાસ અને કલા	
એકમ - ૪	ઇતિહાસ શિક્ષણમાં મૂલ્યાંકન અને ઇતિહાસ શિક્ષકની સજ્જતા	૨૫%
	૪.૧ સંકલ્પના (એકમ પાઠ મૂલ્યાંકન)	
	૪.૨ બલ્યુપ્રિન્ટ	
	૪.૩ સારા પ્રશ્નપત્રની સંરચના આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો	
	૪.૪ ગુજરાતી કૌશલ્ય – વિષયવસ્તુની સજ્જતાના સંદર્ભમાં ઇતિહાસ શિક્ષકની સજ્જતા	

EC8 : ભૂગોળ પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	પાઠ આયોજનનો વિકાસ	૨૫%
	૧.૧ તાસ પાઠ આયોજન	
	૧.૨ એકમ પાઠ આયોજન	
	૧.૩ તાસ અને એકમ પાઠ આયોજનની તુલના	
એકમ - ૨	ભૂગોળ શિક્ષણની પદ્ધતિઓ	૨૫%
	૨.૧ પ્રાદેશિક પદ્ધતિ	
	૨.૨ નમૂના અભ્યાસ પદ્ધતિ	
	૨.૩ પ્રોજેક્ટ પદ્ધતિ	
	૨.૪ આગમન-નિગમન પદ્ધતિ	
એકમ - ૩	ભૂગોળનો અન્ય વિભયો સાથેનો અનુબંધ અને શિક્ષક સજ્જતા	૨૫%
	૩.૧ અર્થ : ઇતિહાસ, વિજ્ઞાન, ગણિત, અર્થશાસ્ત્ર	
	૩.૨ ભૂગોળ શિક્ષકની સજ્જતા : ગુણ, વિષયવસ્તુ, વિશિષ્ટ કૌશલ્યો	
	૩.૩ કિયાત્મક સંશોધન : સંકલ્પના, સોપાનો	
એકમ - ૪	મૂલ્યાંકન	૨૫%
	૪.૧ પ્રશ્ન પ્રકાર : (સંકલ્પના, સંરચના અને ઉદાહરણ)	
	૪.૧.૧ નિબંધલક્ષી	
	૪.૧.૨ લઘુજીવાણી	
	૪.૧.૩ વસ્તુલક્ષી (ખાલીજગા, જોડકા, બહુવિકલ્પ, સંબંધ ઘટાયક)	
	૪.૨ બિલ્યુ પ્રિન્ટની સંરચના	
	૪.૩ આદર્શ પ્રશ્નપત્રના લક્ષણો	

EC9 : નામાના મૂળતત્વો પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	નામાના મૂળતત્વોના શિક્ષણકાર્યનું આયોજન	૨૫%
	૧.૧ શૈક્ષણિક કાર્યના આયોજનની સંકલપના, મહત્વ, પ્રકારો	
	૧.૨ છૂટા પાઠ : સંકલપના અને આયોજન	
	૧.૩ એકમ આયોજન : સંકલપના અને આયોજન	
	૧.૪ છૂટાપાઠ અને એકમપાઠ વચ્ચેનો તફાવત	
એકમ - ૨	નામાના મૂળતત્વોના શિક્ષણમાં સુધારણા પ્રવૃત્તિઓ	૨૫%
	૨.૧ દઢિકરણ	
	૨.૨ પુનરાવલોકન	
	૨.૩ નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય	
	૨.૪ સંકલપના પ્રાપ્તિ પ્રતિમાન (સંકલપના, વિનિયોગ અને મહત્વ)	
એકમ - ૩	નામાના મૂળતત્વોનો શિક્ષક અને કિયાત્મક સંશોધન	૨૫%
	૩.૧ જરૂરી શૈક્ષણિક લાયકાત, ગુણો—કૌશલ્યો	
	૩.૨ કિયાત્મક સંશોધન	
	૩.૨.૧ સંકલપના	
	૩.૨.૨ મહત્વ	
	૩.૨.૩ સોપાનો	
એકમ - ૪	નામાના મૂળતત્વોના શિક્ષણમાં મૂલ્યાંકન	૨૫%
	૪.૧ મૂલ્યાંકનની સંકલપના, હતુઓ, સોપાનો	
	૪.૨ પ્રશ્નોના પ્રકાર : (સંકલપના, સારા નિબંધ પ્રશ્નોના લક્ષણો)	
	૪.૩ ટૂંકોતારી પ્રશ્નો : (સંકલપના, મહત્વ)	
	અનાત્મલક્ષી : ખાલીજુયા, જોડકાં કસોટી, બહુવિકલ્પ કસોટી (રચના, મહત્વ)	
	૪.૪ જલ્દ્યુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર સંરચના	

EC10 : અર્થશાસ્ત્ર પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	અર્થશાસ્ત્રના અધ્યાપનના પાઈ આયોજન ૧.૧ છૂટા તાસનું આયોજન ૧.૨ એકમ પાઠનું આયોજન (વિશિષ્ટ હેતુઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સાધનો, સંદર્ભ અને મૂલ્યાંકન) ૧.૩ માર્શિક આયોજન અને વાર્ષિક આયોજનની સંકલપના અને મહત્વ	૨૫%
એકમ - ૨	અર્થશાસ્ત્રનો અન્ય વિભય સાથે અનુબંધ અને કિયાત્મક સંશોધન ૨.૧ અનુબંધ : ભૂગોળ, ગણિત, સમાજશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર ૨.૨ કિયાત્મક સંશોધન ૨.૨.૧ સંકલપના ૨.૨.૨ મહત્વ ૨.૨.૩ સોપાનો	૨૫%
એકમ - ૩	અર્થશાસ્ત્રના શિક્ષકની વિશિષ્ટતાઓ અને નિદાન-ઉપચાર કાર્ય ૨.૧ અર્થશાસ્ત્ર શિક્ષકની વિશિષ્ટતાઓ : વિભયવસ્તુનું શાન, ક્ષેત્ર કાર્ય અને કૌશલ્યના સંદર્ભમાં ૨.૨ નિદાનાત્મક કાર્ય ૨.૩ ઉપચારાત્મક કાર્ય	૨૫%
એકમ - ૪	અર્થશાસ્ત્રના શિક્ષણમાં મૂલ્યાંકન ૪.૧ મૂલ્યાંકનની સંકલપના, હતુઓ, સોપાનો ૪.૨ પ્રશ્નોના પ્રકાર : (સંકલપના, સારા નિબંધ પ્રશ્નોના લક્ષણો) ૪.૩ ટૂંકોતરી પ્રશ્નો : (સંકલપના, મહત્વ) અનાત્મલક્ષી : ખાલીજીયા, જોડકાં કસોટી, બહુવિકલ્પ કસોટી (રચના, મહત્વ) ૪.૪ બલ્યુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર સંરચના	૨૫%

EC11 : વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પદ્ધતિ (સેમ.૨)

એકમ - ૧	વાણિજ્ય શિક્ષણ કાર્યનું આયોજન	૨૫%
	૧.૧ આયોજનનું મહત્વ	
	૧.૨ છૂટા પાઠની સંકલપના, સોપાનો, લાભ-મર્યાદા	
	૧.૩ છૂટા પાઠનું આયોજન	
	૧.૪ એકમ પાઠની સંકલપના	
એકમ - ૨	પાઠ્યપુસ્તક અને સુધારણા	૨૫%
	૨.૧ અગત્ય	
	૨.૨ સારા પાઠ્યપુસ્તકના લક્ષણો	
	૨.૩ પાઠ્યપુસ્તકનું વિવેચન	
	૨.૪ વાણિજ્ય વિભયનો અન્ય વિભયો સાથેનો અનુબંધ (અર્થશાસ્ત્ર, નામુ, બેંકિંગ, સેકેટરીયલ પ્રેક્ટીસ)	
એકમ - ૩	પાઠ્યકાર અને અભ્યાસકમની સંકલપના અને તુલના	૨૫%
	વાણિજ્ય શિક્ષક અને ડિયાત્મક સંશોધન	
	૩.૧ શિક્ષકની લાયકાત, ગુણો	
	૩.૨ શિક્ષકની વ્યાવસાયિક સજજતા	
	૩.૩ ડિયાત્મક સંશોધન : સંકલપના અને સોપાનો	
એકમ - ૪	મૂલ્યાંકન અને પરીક્ષણ	૨૫%
	૪.૧ પ્રશ્ન પ્રકાર : નિબંધ પ્રકાર, ટૂકોતરી, અનાત્મલક્ષી પ્રશ્નોની સંકલપના, અગત્ય, મર્યાદા	
	૪.૨ આદર્શ પ્રશ્નપત્રનાં લક્ષણો	
	૪.૩ નિપરિમાણદર્શક સારણીનાં આધારે પ્રશ્નપત્રની રચના	
	૪.૪ નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય	

પરિશિષ્ટ

Pedagogy of School Subject (SSC)

SSC વિષય	સેમેસ્ટર- ૧	સેમેસ્ટર- ૨	સેમેસ્ટર- ૩
ગુજરાતી	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
હિન્દી	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
સંસ્કૃત	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
અંગ્રેજી	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
ગણિત	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
વિજ્ઞાન	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
ઇતિહાસ	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
ભૂગોળ	ધોરણ- ૭	ધોરણ - ૮	ધોરણ - ૮
નામાના મૂળતત્ત્વો	ધોરણ - ૧૧	ધોરણ - ૧૨ (વિભાગ - ૧)	ધોરણ - ૧૨ (વિભાગ - ૨)
અર્થશાસ્ત્ર	ધોરણ - ૧૧	ધોરણ - ૧૨ (વિભાગ - ૧)	ધોરણ - ૧૨ (વિભાગ - ૨)
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન	ધોરણ - ૧૧	ધોરણ - ૧૨ (પાઠ ૧ થી ૮)	ધોરણ - ૧૨ (પાઠ ૯ થી બધા)

નોંધ :

- (૧) ધોરણ - ૭, ૮, ૯ અને ૧૧ નો અભ્યાસક્રમ એટલે પ્રત્યેકમાં સમગ્ર વર્ષનો અભ્યાસક્રમ સમજવો.
- (૨) ઇતિહાસ-ભૂગોળ માટે : નાગરિકશાસ્ત્રનો ભાગ ઇતિહાસ સાથે અને અર્થશાસ્ત્રનો ભાગ ભૂગોળ સાથે ગણવો.

નોંધ :

SSC વિષયમાં નામાના મૂળતત્ત્વો વિષયમાં નીચે મુજબ સુધારો કરેલ છે.

નામાના મૂળતત્ત્વો	ધોરણ - ૧૧ સેમેસ્ટર-૧ નું પુસ્તક	ધોરણ - ૧૧ સેમેસ્ટર-૨ નું પુસ્તક	ધોરણ - ૧૨ બંને સેમેસ્ટરના પુસ્તક
-------------------	------------------------------------	------------------------------------	-------------------------------------